



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૩/૦૩/૨૦૧૯ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૨૪/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૯૧ કેસ કરી, ૭૯ વ્યક્તિઓને ઝડપી, ૩૮૬ લીટર દેશી દારૂ, ૫૧૬ બોટલ ઇંગ્લીશ દારૂ, ૪૧ બિયર ટીન, ૧ છોટા હાથી ગાડી અને ૨ રિક્ષા કબજે કરી હતી. તેમજ જુગારધારા હેઠળ ૮ કેસ કરી ૨૧ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૫૪,૮૨૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૨૫/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૨૨૦૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૭૦ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૧૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૫૨૬/૧૯

નારોલ: શંકરલાલ જગદીશભાઈ ડાલમીયા (રહે. નિગમ સોસાયટી સ્મૃતિ મંદીર રોડ) એ તા.૨૨/૩/૧૯ નારોજ નારોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૦/૩/૧૯ સાજના ૭/૦૦ થી તા.૨૨/૩/૧૯ કલાક ૯/૩૦ વાગ્યા દરમિયાન નારોલ વિલસન હોટલ ગલી મા કેલીકોનગરમા જે.ડી એસ ફિબ્રેક ગોડાઉન નં ૮.૯.૧૦ ખાતે ગોડાઉનના પતરા તોડી અજાણી વ્યક્તિ ગોડાઉનમાંથી ૭૪૭૬ મીટર કાપડ કિમત રૂપિયા ૧,૦૨,૯૫૪/- ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી આર.એ.જાદવ ચલાવે છે.

લુંટની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૫૨૭/૧૯

એરપોર્ટ: દેવાજી થાનાજી ધાંચી (ઉ.વ.૫૬) (રહે.કલાપીનગર અસારવા) તા.૨૧/૩/૧૯ રાતના ૮/૦૦ વાગ્યાના સુમારે ઇન્દીરાબ્રીજ ઓમદાસજી હોલ સામેથી પત્ની સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ દેવાજી ધાંચીના પત્નીના ગળામાંથી સોનાનુ મંગળસુત્ર કિમત રૂપિયા ૧,૧૦,૦૦૦/- ભેચી તોડી લુંટ કરી નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ દેવાજી ધાંચીએ એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.બી.પ્રજાપતી ચલાવે છે.

શાહપુર: સતીષભાઈ જીવણભાઈ ધોબી (ઉ.વ.૪૦) (રહે. ભવાનપુરાની પોળ શાહપુર) એ આર્થિક સંકડામણને લીધે તા.૨૨/૩/૧૯ કલાક ૮/૪૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે પિંન્ટીંગ પ્રેસમા વપરાતુ કેમીકલ પી લીધુ હતુ. સારવાર માટે તેમને સીવીલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન કલાક ૧૧/૦૦ વાગે તેમનું મૃત્યુ નિપજયું હતુ. આ અંગે શાહપુર પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી એન.કે.ડામોર ચલાવે છે.

ઓઢવ: તખુબહેન શામજીભાઈ પ્રજાપતી (ઉ.વ.૬૨) (રહે. વિમલપાર્ક સોસાયટી ઓઢવ) એ બિમારીથી કંટાળી તા.૨૨/૩/૧૯ સવારના ૧૧/૧૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે છતના હુકમાં વીજ વાયર બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ઓઢવ પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી પી.કે.મકવાણા ચલાવે છે.

રામોલ: વૃષાંક સ/ઓ હિતેષભાઈ પટેલ (ઉ.વ.૨૧) (રહે. માતૃ બંગલોઝ અયોધ્યાનગર પાસે ન્યુ મણીનગર સી.ટી.એમ.રામોલ) એ અગમ્ય કારણસર તા.૨૨/૩/૧૯ કલાક ૬/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખાના હુકમાં દુપટ્ટે બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે રામોલ પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી મનુભાઈ વિરાભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.